



| વિષય            | માળખાં                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                | કુલ ગુણ 80     |
|-----------------|-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|----------------|
| ગુજરાતી         | <p>અભ્યાસક્રમ:- પ્રકરણ -1 થી 10, વ્યાકરણ, લેખન</p> <p>પ્રશ્ન-1(અ) નીચે આપેલા વૈકલ્પિક પ્રશ્નોના સાચો વિકલ્પ શોધીને લખો. (દરેકનો 1 ગુણ)(04)</p> <p>પ્રશ્ન:1(બ) નીચે આપેલ ખાલી જગ્યા પૂરો. [04]</p> <p>પ્રશ્ન-1(ક) નીચે આપેલ વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. (04)</p> <p>પ્રશ્ન:2 (અ) નીચે આપેલ વિધાનોમાંથી ખોટો વિકલ્પ છેડી સાચું વાક્ય બનાવો. [03]</p> <p>પ્રશ્ન:2 (બ) નીચેની કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો. [02]</p> <p>પ્રશ્ન:2 (ક) નીચે આપેલી માહિતીના આધારે પ્રશ્નોના જવાબ લખો. [05]</p> <p>પ્રશ્ન:3 (અ) નીચેના પ્રશ્નોના એક -એક વાક્યમાં ઉત્તર લખો. [06]</p> <p>પ્રશ્ન:3 (બ) નીચેના પ્રશ્નોના બે - ત્રણ વાક્યોમાં ઉત્તર લખો. (ગમે તે ત્રણ) [06]</p> <p>પ્રશ્ન:3 (ક) નીચેના પ્રશ્નોના ત્રણ - ચાર વાક્યોમાં ઉત્તર લખો. (ગમે તે બે) [06]</p> <p>પ્રશ્ન:4 સૂચના પ્રમાણે કરો.</p> <p>(1) નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. [01]</p> <p>(2) નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો. [01]</p> <p>(3) નીચેના શબ્દોની સાચી જોડણી લખો. [01]</p> <p>(4) નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. [01]</p> <p>(5) નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. [01]</p> <p>(6) નીચે આપેલ વાક્યનો પ્રકાર જણાવો. [01]</p> <p>(7) નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખો. [01]</p> <p>પ્રશ્ન: 5 (અ) નીચે આપેલ ચિત્રનું વર્ણન કરો.. [05]</p> <p>પ્રશ્ન: 5 (બ) નીચે આપેલા મુદ્દા પરથી વાર્તા લખી યોગ્ય શીર્ષક આપો. [05]</p> <p>પ્રશ્ન: 5 (ક) નીચેનામાંથી કોઈપણ એક વિષય પર નિબંધ લખો. [10]</p> <p>(8) નીચેના વાક્યમાંથી વિશેષ્ય શોધીને લખો. [01]</p> <p>(9) નીચેના વાક્યમાંથી ક્રિયાવિશેષણ શોધીને લખો. [02]</p> <p>(10) નીચેના વાક્યમાંથી નામપદ શોધીને લખો. [02]</p> <p>(11) નીચેના વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો. [02]</p> <p>(12) નીચે આપેલ સંજ્ઞાના પ્રકાર જણાવો. [02]</p> <p>(13) નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. [02]</p> <p>(14) નીચેના શબ્દોનો વાક્યોમાં પ્રયોગ કરો. [02]</p> |                |
| સામાજિક વિજ્ઞાન | <p>અભ્યાસક્રમ:- પ્રકરણ - [1,2,3,4,9,10,14,15]</p> <p>પ્રશ્ન:1 (અ) નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. [10]</p> <p>પ્રશ્ન:1 (બ) યોગ્ય શબ્દો વડે નીચેનાં વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. [06]</p> <p>પ્રશ્ન:1 (ક) નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો. [06]</p> <p>પ્રશ્ન:2 (અ) શબ્દોની સમજ આપો. (ગમે તે ત્રણ) [06] પ્રશ્ન:2 (બ) બંધબેસતાં જોડકાં જોડો. [04]</p> <p>પ્રશ્ન:2 (ક) નીચેના પ્રશ્નોના જવાબ એક - બે વાક્યોમાં લખો. (ગમે તે આઠ) [08]</p> <p>પ્રશ્ન:3 (અ) આકૃતિ દોરો. [04]</p> <p>પ્રશ્ન:3 (બ) નીચેના પ્રશ્નોના જવાબ બે-ત્રણ વાક્યોમાં લખો. (ગમે તે છ) [12]</p> <p>પ્રશ્ન:4 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. (ગમે તે ચાર) [12]</p> <p>પ્રશ્ન:5 ટૂંકનોંધ લખો. (ગમે તે ત્રણ) [12]</p>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                   | કુલ ગુણ 80     |
| English         | <p>Syllabus:- ( Unit 1 to 4 &amp; Grammar- 1 to 9, Essay writing)</p> <p>Q-1(A) Write the answer with the help of multiple choice of questions. [06]</p> <p>(B) Fill in the blanks. [06]</p> <p>(C) Read the paragraph and answer the following questions. [05]</p> <p>(D) Convert the given sentences into negative by replacing the underlined words with the words given in the brackets. [ is / am / are was / were] [05]</p> <p>(E) Who Said to whom. [05]</p> <p>Q-2(A) Fill in the blanks using has / have / had [06]</p> <p>(B) Convert the given sentences into inversion Questions.(There) [06]</p> <p>(C) Fill in the blanks using correct preposition [06]</p> <p>(D) Fill in the blanks using articles a / an / the. [05]</p> <p>Q-3 (A) Fill in the blanks with the simple present tense forms of the verbs given in the brackets. [05]</p> <p>(B) Fill in the blanks with the simple past tense forms of the verbs given in the brackets. [05]</p> <p>(C) Fill in the blanks with the present continuous tense forms of the verbs given in the brackets.[05]</p> <p>(D) Draw clocks hand for each of following time.[05]</p> <p>Q-4 Complete the dialogue using the sentences given in the box. [05]</p> <p>Q-5 Write any one Essay. [05]</p>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                          | Total Marks 80 |

|         |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                              |            |
|---------|--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|------------|
| ગણિત    | <p>અભ્યાસક્રમ:- પ્રકરણ - 1 થી 6</p> <p>પ્રશ્ન:1 (અ) નીચે દરેક પ્રશ્નના જવાબ માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. [10]</p> <p>પ્રશ્ન:1 (બ) નીચેનાં વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. [10]</p> <p>પ્રશ્ન:2 (અ) નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો. [06]</p> <p>પ્રશ્ન:2 (બ) સાચાં જોડકાં બનાવો. [04]</p> <p>પ્રશ્ન:3 નીચેના પ્રશ્નોના જવાબ આપો. (ગમે તે આઠ) [16]</p> <p>પ્રશ્ન:4 નીચેના પ્રશ્નોના જવાબ આપો.(ગમે તે છ) [18]</p> <p>પ્રશ્ન:5 નીચેના પ્રશ્નોના જવાબ આપો.(ગમે તે ચાર) [16]</p>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                | કુલ ગુણ 80 |
| વિજ્ઞાન | <p>અભ્યાસક્રમ:- પ્રકરણ -1 થી 5,7</p> <p>પ્રશ્ન: 1 (અ) નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. [10]</p> <p>પ્રશ્ન: 1 (બ) તફાવતના બે મુદ્દા લખો. (ગમે તે ત્રણ) [06] પ્રશ્ન: 1 (ક) વ્યાખ્યા આપો (ગમે તે ત્રણ) [06]</p> <p>પ્રશ્ન: 2 (અ) ખાલી જગ્યા પૂરો. [05]</p> <p>પ્રશ્ન: 2 (બ) નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. (ગમે તે પાંચ) [10]</p> <p>પ્રશ્ન: 2 (ક) નીચે આપેલા પ્રયોગનું આકૃતિ સહિત વર્ણન કરો.(કોઈ પણ એક) [05]</p> <p>પ્રશ્ન: 3 (અ) વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. (ગમે તે ત્રણ) [09]</p> <p>પ્રશ્ન: 3 (બ) નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. (ગમે તે ત્રણ)[12]</p> <p>પ્રશ્ન: 3 (ક) યોગ્ય જોડકાં જોડો.[03]</p> <p>પ્રશ્ન: 4 (અ) નીચેના પ્રશ્નોના એક શબ્દમાં ઉત્તર આપો.[05]</p> <p>પ્રશ્ન: 4 (બ) નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.[05]</p> <p>પ્રશ્ન: 4 (ક) વર્ગીકરણ કરો.[04]</p>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                             | કુલ ગુણ 80 |
| હિન્દી  | <p>અભ્યાસક્રમ:- ૧ થી ૮ (વ્યાકરણ, લેખન) નિબંધ- કહાની</p> <p>પ્રશ્ન-૧(અ) નિમ્નલિખિત પ્રત્યેક પ્રશ્ન કે ઉત્તર કે લિખ દિજો વિકલ્પોં મેં સે સહી વિકલ્પ ચુનકર લિખિજો. [10]</p> <p>(બ) નિમ્નલિખિત પ્રશ્નોં કે ઉત્તર ઇક - ઇક વાક્ય મેં લિખિજો. [06]</p> <p>(ક) નિમ્નલિખિત પ્રશ્નોં કે ઉત્તર દો - દો વાક્યોં મેં લિખિજો.(કિન્હી ચાર) [08]</p> <p>પ્રશ્ન-૨(અ) નિમ્નલિખિત પ્રશ્નોં કે ઉત્તર ત્રીન- ચાર વાક્યોં મેં લિખિજો. (કિન્હી ત્રીન) [09]</p> <p>(બ) નિમ્નલિખિત કાવ્ય - પંક્તિયોં પૂર્ણ કીજિજો. (કિન્હી ઇક) [05]</p> <p>(ક) નિમ્નલિખિત રિક્ત - સ્થાનોં કી પૂર્તિ કીજિજો. [06]</p> <p>પ્રશ્ન-૩ સુચના અનુસાર કીજિજો. - વ્યાકરણ [22][મુહાવરે, સમાનાર્થી,વિરોધી,વચન,લિંગ,શબ્દકોશ કે ક્રમ, વિશેષણ]</p> <p>પ્રશ્ન-૪(અ)નિમ્નલિખિત વિષયોં મેં સે કિસી ઇક વિષય પર નિબંધ લિખિજો. [08]</p> <p>(બ)નિમ્નલિખિત રૂપરેખા કે આધાર પર કહાની લિખિજો ઓર ઉસે ઉચિત શીર્ષક દીજિજો. [06]</p>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                               | કુલ ગુણ 80 |
| સંસ્કૃત | <p>અભ્યાસક્રમ:- પ્રકરણ - વંદના, 1 થી 9</p> <p>પ્રશ્ન: 1 (અ) નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. [10]</p> <p>પ્રશ્ન: 1 (બ) નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. [04] પ્રશ્ન: 1 (ક) નીચે આપેલા વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો. [04]</p> <p>પ્રશ્ન: 2 (અ) નીચે આપેલા જોડકાં જોડો. [04]</p> <p>પ્રશ્ન: 2 (બ) નીચે આપેલા વાક્યોમાંથી નામપદ અને ક્રિયાપદ શોધો. [04]</p> <p>પ્રશ્ન: 2 (ક) નીચે આપેલ ઘડિયાળમાં સમય જોઈને શબ્દો અને અંકમાં સમય લખો.[05]</p> <p>પ્રશ્ન: 2 (ડ) નીચેના ચિત્રો જોઈને સંસ્કૃત અને ગુજરાતીમાં નામ લખો.[05]</p> <p>પ્રશ્ન: 3 (અ) નીચે આપેલા શ્લોક પૂર્ણ કરો. [02]</p> <p>પ્રશ્ન: 3 (બ) નીચે આપેલા શ્લોકનું ભાષાંતર ગુજરાતીમાં લખો. [04]</p> <p>પ્રશ્ન: 3 (ક) નીચે આપેલા ગદ્યખંડોનું ભાષાંતર ગુજરાતીમાં લખો [06]</p> <p>પ્રશ્ન: 3 (ડ) નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. [04]</p> <p>પ્રશ્ન: 4 (અ) નીચે આપેલા પ્રશ્નોના જવાબ ગુજરાતીમાં લખો [06]</p> <p>પ્રશ્ન: 4 (બ) નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો [04]</p> <p>પ્રશ્ન: 4 (ક) નીચે આપેલા ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં ભાષાંતર કરો. [04]</p> <p>પ્રશ્ન: 5 (અ) નીચે આપેલી સંખ્યાને સંસ્કૃત અંકમાં અને સંસ્કૃત શબ્દમાં લખો. [04]</p> <p>પ્રશ્ન: 5 (બ) નીચે આપેલ શબ્દોનો સાચો અર્થ લખો. [05]</p> <p>પ્રશ્ન: 5 (ક) નીચે આપેલા શબ્દોને સ્ત્રીલિંગ, પુલિંગ, નપુંસકલિંગમાં વર્ગીકરણ કરો. [05]</p> | કુલ ગુણ 80 |

|           |                                                                                                                                                                                       |             |
|-----------|---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|-------------|
| કમ્પ્યુટર | અભ્યાસક્રમ : Ch-1 to 4<br>❖ નીચે આપેલા વૈકલ્પિક પ્રશ્નનો સાચો વિકલ્પ શોધીને OMR ઉત્તર પત્રકમાં લખો. (દરેકનો એક ગુણ) (20)<br>(પ્રાયોગિક) સૂચના પ્રમાણે કરો. (20) આંતરિક મૂલ્યાંકન (10) | કુલ ગુણ: 50 |
|-----------|---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|-------------|

વિદ્યાર્થી મિત્રો! “પરીક્ષા ઉત્સવ છે, ઉત્સાહથી ઉજવો.” વાચન +મનન+લેખન=સફળતા

## પ્રથમ સત્રાંત પરીક્ષાનું સમયપત્રક- 2024

ઘોરણ- 6

| તારીખ | 17-10-24  | 18-10-24 | 19-10-24 | 21-10-24 | 22-10-24 | 23-10-24   | 24-10-24 | 25-10-24 |
|-------|-----------|----------|----------|----------|----------|------------|----------|----------|
| વાર   | ગુરુવાર   | શુક્રવાર | શનિવાર   | સોમવાર   | મંગળવાર  | બુધવાર     | ગુરુવાર  | શુક્રવાર |
| વિષય  | કમ્પ્યુટર | વિજ્ઞાન  | ગણિત     | ગુજરાતી  | હિન્દી   | સા.વિજ્ઞાન | અંગ્રેજી | સંસ્કૃત  |

નોંધ:-

- ❖ પ્રથમ સત્રાંત પરીક્ષાનો અભ્યાસક્રમ પ્રથમ સત્રનો જ રહેશે અને પ્રથમ સત્રાંત પરીક્ષા જે તે વિષયના માળખાં પ્રમાણે રહેશે.
- ❖ પરીક્ષા દરમિયાન શાળા રાખેતા મુજબ શરૂ રહેશે અને પરીક્ષા શાળા સમય દરમિયાન લેવામાં આવશે.
- ❖ પરીક્ષાના દિવસે જે વિષયની પરીક્ષા હોય તે વિષયના પુસ્તકો લાવવાના રહેશે અને પરીક્ષાનો સમય 11:15 કલાકથી 1:45 કલાક સુધીનો રહેશે.
- ❖ કમ્પ્યુટરના વિષયની પ્રાયોગિક પરીક્ષા 20 ગુણની અને 20 ગુણની થીયરી MCQ પ્રકારની રહેશે અને 10 ગુણ આંતરિક મૂલ્યાંકનના રહેશે.
- ❖ પ્રથમ સત્રાંત પરીક્ષાનું આંતરિક મૂલ્યાંકન તા. 14/10/2024 થી તા. 16/10/2024 દરમિયાન રહેશે, જેનું સમયપત્રક વર્ગશિક્ષક દ્વારા અલગથી જાણાવવામાં આવશે.
- ❖ આંતરિક મૂલ્યાંકનમાં :- હોમવર્ક, નોટબુક, યુનિટ ટેસ્ટ, હાજરી, અનુલેખન, શ્રુતલેખન, વિકલી ટેસ્ટ, વાંચન, સ્કૂલ ડાયરી અને સ્વયંશિસ્તને ધ્યાનમાં રાખીને જે – તે વિષયનું આંતરિક મૂલ્યાંકન કરવામાં આવશે.
- ❖ પરીક્ષા દરમિયાન ગેરહાજર રહેનાર વિદ્યાર્થીની પરીક્ષા અલગથી લેવામાં આવશે નહીં. પરીક્ષા માટેની જરૂરી વસ્તુઓ સાથે જ લાવવી.
- ❖ પ્રથમ સત્રાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ શાળા રાખેતા મુજબ શરૂ રહેશે. જેની ખાસ નોંધ લેવી.
- ❖ દિવાળી વેકેશન તા.:- 28/10/2024 ને સોમવાર થી તા.:-17/11/2024 સુધી રહેશે.
- ❖ દ્વિતીય સત્રનો પ્રારંભ તા.:- 18/11/2024 ને સોમવારથી થશે.

વાલીશ્રીની સહી :-\_\_\_\_\_

Best Of Luck